



AAV-002-001216

Seat No. _____

B. Com. (CBCS) (Sem. II) Examination

April / May – 2016

Insurance - II

(New Course)

Faculty Code : 002

Subject Code : 001216

Time : **2.30** Hours]

[Total Marks : **70**

સૂચના : (૧) પ્રશ્ન - ૧ MCQ પ્રકારનો પ્રશ્ન છે.

(૨) પ્રશ્ન - ૨ થી ૬ વિસ્તારપૂર્વકના પ્રશ્ન છે.

વિભાગ - ૧

૧ વૈકલ્પિક પસંદગીના પ્રશ્નો :

૨૦

(૧) આગનો વીમો સામાન્ય રીતે કટેલા સમય માટે આપવામાં આવે છે ?

(A) બે વર્ષ

(B) ત્રણ વર્ષ

(C) ચાર વર્ષ

(D) એક વર્ષ

(૨) આગના વીમામાં શેનું જોખમ સમાવવામાં આવે છે ?

(A) હવા

(B) આગ

(C) પાણી

(D) જમીન

(૩) આગના વીમાની કઈ પોલીસીમાં નુકશાન ભરપાઈ કરવાના સિદ્ધાંતનું પાલન કરવામાં આવે છે ?

(A) નક્કી કરેલી કિંમત

(B) કિંમતી વસ્તુ

(C) નક્કી કરેલ વસ્તુ

(D) વધારાની વસ્તુ

(૪) ધ ગ્રેટ ફાયર ઓફ લંડન કયા વર્ષમાં થઈ હતી ?

(A) ૧૬૬૦

(B) ૧૬૬૨

(C) ૧૬૬૬

(D) ૧૬૭૦

- (પ) દરિયાઈ વીમામાં શેનું જોખમ સમાવવામાં આવે છે ?
- (A) પાણી (B) હવા
- (C) જમીન (D) આગ
- (દ) ઈન્ડિયન મરીન ઈન્શ્યુરન્સ એક્ટનો અમલ વર્ષમાં થયો .
- (A) ૧૯૬૩ (B) ૧૮૬૩
- (C) ૧૭૬૩ (D) ૧૬૬૩
- (૭) જહાજના માલના રક્ષણ સંબંધિત વીમો લેવામાં આવે તે વીમાને કહેવાય છે.
- (A) નૂર (B) માલવાહક
- (C) જવાબદારી (D) આમાંથી એક પણ નહીં
- (૮) એવી પોલીસી જેમાં નક્કી કરેલ સફરનો નક્કી કરેલા સમય માટે જોખમનો સમાવેશ થતો હોય, તે પોલીસીને કહેવાય...
- (A) સફરની પોલીસી (B) સમયની પોલીસી
- (C) નક્કી કરેલી કિંમતની પોલીસી (D) આમાંથી એક પણ નહીં
- (૯) મોટરવીમામાં સંપૂર્ણ નુકશાન એટલે શું ?
- (A) RTA દ્વારા વાહનની જપ્તી લઈ લેવામાં આવે
- (B) વાહનમાં થોડુંક નુકશાન
- (C) વાહનની ચોરી થવી
- (D) આમાંથી એક પણ નહીં
- (૧૦) ભારતમાં મોટર વ્હીકલ એક્ટ વર્ષમાં પસાર થયો.
- (A) ૧૯૪૭ (B) ૧૯૩૯
- (C) ૧૯૦૩ (D) ૧૯૩૦
- (૧૧) પબ્લિક લાયબિલીટી ઈન્શ્યુરન્સ એક્ટનો અમલ વર્ષમાં થયો.
- (A) ૧૯૩૦ (B) ૧૯૯૦
- (C) ૧૯૯૧ (D) ૧૯૯૫
- (૧૨) ઘરફોડ ચોરી વીમો કોના માટે છે ?
- (A) દુકાનદાર (B) કારખાનેદાર
- (C) ઓફિસર (D) આ બધા માટે

(૧૩) વ્યક્તિગત અકસ્માત વીમામાં કઈ ઈજાને સમાવવામાં આવતી નથી ?

- (A) જાણીજોઈને કરેલ વ્યક્તિગત ઈજા (B) કૂતરો કરડવાથી થયેલ ઈજા
(C) રમતગમતના કારણે થયેલ ઈજા (D) અકસ્માતમાં થયેલ ઈજા

(૧૪) પ્રાણીના મૃત્યુ, અકસ્માત, માંદગી અથવા બીમારીથી થતા નુકશાનને સમાવવામાં આવતી પોલીસી છે.

- (A) પશુ વીમો (B) ખેડૂત વીમો
(C) ખેતી વીમો (D) આમાંથી એક પણ નહીં

(૧૫) ભારતમાં મેડીકલેઈમ પ્રસ્તુત ક્યારે કરવામાં આવ્યો ?

- (A) ૧૯૫૪ (B) ૧૯૯૨
(C) ૧૯૮૬ (D) ૧૯૮૫

(૧૬) જૂથ વીમો આદર્શ રીતે કોને સમાવવામાં માટે યોગ્ય છે.

- (A) સમાજના પછાત વર્ગને (B) માલિક-કર્મચારી જૂથ
(C) (A) અને (B) બંને (D) આમાંથી એક પણ નહીં

(૧૭) લાઈફ ઈન્શ્યુરન્સ કોર્પોરેશન એક્ટનો અમલ ભારતમાં વર્ષમાં થયો.

- (A) ૧૯૪૭ (B) ૧૯૫૬
(C) ૧૯૫૭ (D) ૧૯૯૯

(૧૮) IRDA એક્ટ ૧૯૯૯ ક્યારથી અમલમાં આવ્યો ?

- (A) એપ્રિલ, ૨૦૦૦ (B) મે, ૨૦૦૦
(C) એપ્રિલ, ૧૯૯૯ (D) મે, ૧૯૯૯

(૧૯) સીધી માર્કેટિંગ ચેનલ ને કહેવાય.

- (A) શૂન્ય સ્તર ચેનલ (B) એક સ્તર ચેનલ
(C) બે સ્તર ચેનલ (D) ત્રણ સ્તર ચેનલ

(૨૦) ઈન્શ્યુરન્સ એક્ટનો અમલ કયા વર્ષમાં થયો ?

(A) ૧૯૩૦

(B) ૧૯૫૬

(C) ૧૯૩૮

(D) ૧૯૯૭

વિભાગ - ૨

૨ આગના વીમાનો અર્થ આપો. આગના વીમાની પોલીસી લેવાની વિધિ સ્પષ્ટ કરો. ૧૦

અથવા

૨ આગના વીમાની પોલીસી રદ કરવા અને જપ્ત કરવા અંગેની સમજૂતી આપો. ૧૦

૩ દરિયાઈ વીમા પોલીસીના પ્રકાર સમજાવો. ૧૦

અથવા

૩ તફાવત આપો - આગનો વીમો અને દરિયાઈ વીમો. ૧૦

૪ મોટર વીમા પર વિસ્તારપૂર્વક નોંધ લખો. ૧૦

અથવા

૪ ઘરફોડ ચોરી વીમો અને જવાબદારી વીમાની સમજૂતી આપો. ૧૦

૫ પશુ વીમો અને પાક વીમાની સમજૂતી આપો. ૧૦

અથવા

૫ વીમા સેવાની માર્કેટિંગ અને અભિવૃદ્ધિની વ્યૂહરચના સમજાવો. ૧૦

૬ ટૂંક નોંધ લખો : (કોઈ પણ બે) ૧૦

(૧) મેડીકલેઈમ વીમા પોલીસી.

(૨) IRDA.

(૩) વફાદારી વીમો.

(૪) વ્યક્તિગત અકસ્માત અને માંદગી વીમો.

ENGLISH VERSION

- Instructions :**
- (1) Que. 1 is MCQ type question.
 - (2) Que. No 2 to 6 are Descriptive type questions.

SECTION - I

1 MCQ type question : 20

- (1) Fire insurance is usually issued for...
 - (A) Two years
 - (B) Three years
 - (C) Four years
 - (D) One year
- (2) Fire insurance covers risks from...
 - (A) Air
 - (B) Fire
 - (C) Water
 - (D) Land
- (3) Which fire policy follows the principle of indemnity ?
 - (A) Valued
 - (B) Valuable
 - (C) Specific
 - (D) Excess
- (4) The Great fire of London took place in the year.
 - (A) 1660
 - (B) 1662
 - (C) 1666
 - (D) 1670
- (5) Marine insurance covers risks in...
 - (A) Water
 - (B) Air
 - (C) Land
 - (D) Fire
- (6) Indian Marine Insurance Act was enacted in...
 - (A) 1963
 - (B) 1863
 - (C) 1763
 - (D) 1663

- (7) The insurance which is related for the safety of goods in the ship is known as... insurance.
- (A) Freight (B) Cargo
- (C) Liability (D) None of these
- (8) The policy which covers the risk during particular voyage for a specific period of time is known as -----
- (A) Voyage policy (B) Time policy
- (C) Valued policy (D) None of these
- (9) Total loss in motor insurance means...
- (A) Confiscation of the vehicle by RTA
- (B) Partial damage of the vehicle
- (C) Theft of the vehicle
- (D) None of these
- (10) In India, Motor Vehicle Act was passed in the year...
- (A) 1947 (B) 1939
- (C) 1903 (D) 1930
- (11) Public Liability Insurance Act was enacted in...
- (A) 1930 (B) 1990
- (C) 1991 (D) 1995
- (12) Burglary insurance is for...
- (A) Shopkeepers (B) Industrialists
- (C) Officers (D) Everyone
- (13) Personal accident insurance does not cover the injuries resulting from...
- (A) Intentional self injury
- (B) Injuries due to dog bite
- (C) Injuries while engaged in sports
- (D) Accidental injuries

- (14) The policy covers the losses due to death, accident, illness or diseases of the animal.
- (A) Cattle Insurance (B) Farmers Insurance
(C) Agriculture Insurance (D) None of these
- (15) Medici claim was introduced in India in..
- (A) 1954 (B) 1992
(C) 1986 (D) 1985
- (16) Group insurance is ideally suited for covering...
- (A) Weaker section of the society
(B) Employer - employee groups
(C) (A) and (B) both
(D) None of these
- (17) The Life Insurance Corporation Act was enacted in India in the year.
- (A) 1947 (B) 1956
(C) 1857 (D) 1999
- (18) IRDA Act 1999 came into force with effect from
- (A) April, 2000 (B) May 2000
(C) April, 1999 (D) May 1999
- (19) Direct marketing channel is also known as..
- (A) Zero level channel (B) One level channel
(C) Two level channel (D) Three level channel
- (20) The Insurance Act was enacted in the year.
- (A) 1930 (B) 1956
(C) 1938 (D) 1897

SECTION - II

- 2** Give meaning of fire insurance. State procedure of taking fire insurance policy. **10**

OR

- 2** Explain cancellation and forfeiture of fire insurance policy. **10**

- 3** Explain types of marine insurance policies. **10**

OR

- 3** Give difference between fire and marine insurance. **10**

- 4** Write a detail note on Motor Insurance. **10**

OR

- 4** Explain Burglary insurance and Liability insurance. **10**

- 5** Explain Cattle insurance and Crop insurance. **10**

OR

- 5** Explain marketing and promotion strategy of insurance services. **10**

- 6** Write short note : (Any two) **10**

- (1) Mediclaim insurance policy.
- (2) IRDA.
- (3) Fidelity Insurance.
- (4) Personal accident and sickness Insurance.